



Arman Financial Services Limited

Registered Office: 502-503, SAKAR III, OPP. OLD HIGH COURT, OFF ASHRAM ROAD, AHMEDABAD-380014, GUJARAT, INDIA
PH.: +91-79-40507000, 27541989 E-mail: finance@armanindia.com CIN: L55910GJ1992PLC018623

Date: February 19, 2025

To, BSE Limited P. J. Tower, Dalal Street, Mumbai-400001	To, National Stock Exchange of India Limited "Exchange Plaza" C-1, Block G, Bandra Kurla Complex, Bandra, Mumbai- 400051
Script Code: 531179 ISIN: INE109C01017	Symbol: ARMANFIN Series: EQ

Dear Sir,

Sub: Newspaper Advertisement – Notice of Postal Ballot and E-Voting Information

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Notice of Postal Ballot and e-voting information were published in the following newspapers on February 19, 2025:

1. Indian Express (English); and
2. Financial Express (Gujarati)

A copy of the Notice published is attached herewith. These are also being made available on the website of the Company at www.armanindia.com.

You are requested to take the same on record.

Thanking you,

Yours faithfully,

For, Arman Financial Services Limited

Jaimish Patel
Company Secretary
M. No.-A42244

KALYAN JEWELLERS INDIA LIMITED

NOTICE OF POSTAL BALLOT

Members are hereby informed that, pursuant to provisions of Section 108 and Section 110 and other applicable provisions of the Companies Act, 2013 (The Act) read with Rule 20 and Rule 22 of Companies (Management and Administration) Rules, 2014, as amended, and read with the General Circular No. 14/2020 dated 04th April, 2020, 17/2020 dated 13th April, 2020, and the latest one being General Circular No. 09/2024 dated September 19, 2024 issued by the Ministry of Corporate Affairs (MCA) and the Registrar of Companies (RoC) and the Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 or re-enactment(s) thereof for the time being in force and as amended from time to time), the Notice of Postal Ballot seeking the consent of the Members by voting through electronic means (e-voting) for items set out in the Postal Ballot dated February 30, 2025 has been sent by e-mail on Tuesday, February 18, 2025, to those members whose names are appearing in the Register of Members/ List of Beneficial Owners as on the cut-off date i.e., Friday, February 14, 2025. Only those Members whose names have registered their e-mail address with the Company / Depositories as on the cut-off date i.e., Friday, February 14, 2025. Only those Members whose names are appearing in the Register of Members/ List of Beneficial Owners as on the cut-off date shall be eligible to cast their votes through postal ballot by remote e-voting. The details regarding the sending physical copy of the Postal Ballot Notice of the Postal Ballot form has been disseminated with under above referred MCA circulars. Members are requested to provide their assets or disinvest through e-voting only.

The Company has appointed National Securities Depository Limited (NSDL) for facilitating e-voting to enable the Members to cast their votes electronically. Members are requested to note that e-voting period will commence on Wednesday, February 19, 2025 at 9:00 a.m. and end on Thursday, March 20, 2025 at 5:00 p.m. The e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. The details regarding the e-voting including the manner in which members holding shares in physical form or who have not registered their email addresses can cast their votes through postal ballot are provided as part of the postal ballot notice sent to the shareholders.

Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email addresses by writing to the Company at cs@kalyanjewellers.net along with the copy of the signed request letter mentioning the name and address of the member, self-attested copy of the PAN card, and self-attested copy of any document (e.g. Driving License, Election Identity Card) in support of the e-mail address of the member. Members holding shares in dematerialized mode are requested to register/update their email addresses with the Company by writing to the Company in case of any queries / difficulties in registering the e-mail address, members may write to cs@kalyanjewellers.net.

The Notice of Postal Ballot along with instructions for remote e-voting is also available on the Company's website at www.kalyanjewellers.net; websites of the Stock Exchanges - BSE Limited (BSE) at www.bseindia.com and National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com and also on the website of NSDL at www.evotingnsdl.com.

The Board of Directors of the Company has appointed Mr. R. R. Thiagarajan, (Membership No. AC5537/COP-6487), Company Secretary in Practice, to act as the Scrutinizer for conducting the postal ballot through the e-voting process in a fair and transparent manner. The result of the Postal Ballot will be declared on or before 5:00 p.m. on Saturday, March 22, 2025 at the Registered Office of the Company. The results of the Postal Ballot will be displayed on the website of the Company www.kalyanjewellers.net and on the website of NSDL e-voting at www.evotingnsdl.com. The results will be simultaneously communicated to the stock exchanges i.e., National Stock Exchange of India Limited and BSE Limited and will also be displayed on the Notice Board of the Company at its registered office.

In case of any queries pertaining to e-voting, Members may refer to the Frequently Asked Questions (FAQs) for shareholders and e-voting user manual for shareholders available at the download section of www.evotingnsdl.com or call on Toll Free No. 1800-222-9900 or send a request at evoting@nsdl.com. Any query or grievance connected with the remote e-voting may be addressed to Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL, 4th Floor, 2nd Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Panel, Mumbai 400 013. Email: evoting@nsdl.com, 1800 222 9900 / 1800 224 030.

For Kalyan Jewellers India Limited
Jishu RG
Company Secretary

Place: Thrissur
Date: 19-02-2025

Kalyan Jewellers India Limited
CIN: L36911ML2009P024441
Registered Office: TC-32/204/2, Starline Hill Road, Punnamam,
Thrissur, Kerala - 680 002
Web: www.kalyanjewellers.net | Email: cs@kalyanjewellers.net

KARNATAKA POWER CORPORATION LIMITED

E-AUCTION NOTIFICATION

(Through KPP Portal of GoI)

(Evaluation of Technical bids and e-Auction live bidding thereafter)

KPCL invites tenders/bids from direct end-users/suppliers to end-users of fly ash. The Auction document can be downloaded from the website: <https://www.kpp.karnataka.gov.in>

BELLARY THERMAL POWER STATION

1) KPCL/2024-25/AUCTION/87 Date: 17.02.2025.

Name of Work: Sale of dry fly ash of approximately 20 lakh MT per annum (17.23 MT per day) on available basis for a period of three years from Bellary, i.e., from Bellary Thermal Power Station - Unit # 1 to 3 of KPCL, located at Bellary Dist., Karnataka, India. Last date for receipt of the completed bids: 17:00 Hrs. on 10.03.2025.

RAICHUR THERMAL POWER STATION

2) KPCL/2024-25/AUCTION/88 Date: 17.02.2025.

Name of Work: Sale of dry fly ash of approximately 50 lakh MT per annum (13.70 MT per day) on 'as available' basis for a period of three years from Raichur, i.e., from Raichur Thermal Power Station - Unit # 1 to 8 of KPCL and Yemasar Thermal Power Station - Unit # 1 & 2 of KPCL, located at Raichur Dist., Karnataka, India. Last date for receipt of the completed bids: 17:00 Hrs. on 10.03.2025.

Further details can be had from the Superintending Engineer (Mines), KPCL, No. 82, Shani Bazar, III Floor, Base Course Road, Bangalore - 560 001, email: sales@kpp.com or KPP-Portal Helpdesk: +91-8046010000 / +91-808944777.

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

MAHARASHTRA SMALL SCALE INDUSTRIES DEVELOPMENT CORPORATION LIMITED
(A Government of Maharashtra Undertaking)

EXENSION TO TENDER FOR MACHINERY /ZOLAMBE-TENDER/2024-25/01

Due to insufficient response to tender, the date of downloading and submission of e-tender is extended upto 5:00 PM on 25.2.2025 and the tenders will be opened on 27.2.2025 at 3:00 PM. All other terms & conditions remain unchanged. MSSIDC reserves right to accept or reject any one or all tenders without assigning the reasons.

Date : 19.02.2025, Place : Mumbai
General Manager

Maharashtra Industrial Township Limited
(A Government Undertaking)

Regd. Off. : Udyog Sarathi, MIDC Office, Marol Industrial Area, Andheri East, Mumbai - 400083.

Tel. No. 022-26879955 Website : www.aurlc.in CIN : UT4999MH011456260132

Maharashtra Industrial Township Ltd. (MITL) is presently developing Industrial Township - Dighi Port Industrial Area spread over land area of approx. 24.5 sq km. MITL invites RFO cum RFP for "Design, Construction, Testing, Commissioning and Operation & Maintenance of Infrastructure Works at Dighi Port Industrial Area (DPIA) - Phase 1 under Dehu Damul Industrial Corridor on EPC Basis - Package A".

(Tender No. : MITL/DPIA/2024-25/001)

The details are available on the websites: <https://aurlc.in>, www.aurlc.in. Interested applicants are requested to submit their responses online for the RFO cum RFP on or before 17th March 2025 at 1600 hrs. Non-transferable processing fees of INR 3.00,00,000/- including taxes shall need to be paid accompanying the submittals through the online E-procurement portal of MITL.

Sd/-
Managing Director, MITL

Arman Financial Services Limited

Regd. Office: 502-503, Sakar III, Opp. Old High Court, Off Ashram Road, Ahmedabad-380014, Ph: 079-40507000, 27541989
CIN: L5910G1992PL018622
Email: finance@armanindia.com Website: www.armanindia.com

NOTICE FOR THE ATTENTION OF MEMBERS OF THE COMPANY

Members of the Company are hereby informed that a Postal Ballot Notice, seeking their consent on the resolutions set out in the said Notice has been sent electronically pursuant to the circulars issued by Ministry of Corporate Affairs, to the members whose e-mail address is registered with the Company/Bigshare Services Private Limited, Company's Registrar and Transfer Agent ("RTA")/ Depository Participant(s)' Depositories, as on Friday, February 14, 2025, i.e., the Cut-Off Date. The Company has completed electronic dispatch of the Postal Ballot Notice on Tuesday, February 18, 2025.

The Postal Ballot Notice is available on the Company's website at www.armanindia.com and the website of the Stock Exchanges, i.e., at BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL at www.evotingnsdl.com. Members who do not receive the Postal Ballot Notice may download it from the above-mentioned websites.

The documents referred to in the Postal Ballot Notice are available for inspection electronically and members seeking to inspect such documents can send an e-mail to secretarial@armanindia.com.

Instruction for e-voting:

The Company is providing to its members the facility to exercise their right to vote on the resolution proposed in the said Postal Ballot Notice only by electronic means ("e-voting"). The communication of the assent or dissent of the members would take place through remote e-voting process only. The Company has engaged the services of NSDL, as the agency to provide e-voting facility. Members may cast their votes during the period mentioned herein below:

Commencement of e-voting Thursday, February 20, 2025 from 9:00 am (IST)
End of e-voting Friday, March 21, 2025 till 5:00 pm (IST)

E-voting will not be allowed beyond the aforesaid date and time and the E-voting module shall be forthwith disabled by NSDL upon expiry of the aforesaid period.

Manner of e-voting by members holding shares in dematerialized mode, physical mode and members who have not registered their e-mail address has been provided in the Postal Ballot Notice. The manner in which persons, who have forgotten the User ID and Password, can obtain/generate the same, has also been provided in the said Notice.

A person whose name is recorded in the Register of Members/ List of Beneficial Owners as on the Cut-Off Date shall only be considered eligible for the purpose of e-voting. A person who becomes a member after the Cut-Off Date should treat this notice for information purpose only.

Manner of registering/ updating e-mail address:

- Members holding shares in physical mode, who have not registered / updated their e-mail address with the Company, are requested to register/ update their e-mail address by writing to the Company with details of folio number, e-mail address and attaching a self-attested copy of the PAN card at secretarial@armanindia.com.
- Members holding shares in dematerialized mode, who have not registered/ updated their e-mail address with the Depository Participant(s) are requested to register/update their e-mail addresses with the Depository Participant(s) with whom they maintain their demat accounts.

The resolution, if approved, shall be deemed to have been passed on the last date of e-voting i.e., March 21, 2025. The results of e-voting will be announced on or before March 23, 2025 and will be displayed on the Company's website www.armanindia.com and on the website of NSDL at www.evotingnsdl.com. The results will be communicated to the Stock Exchanges, National Securities Depository Limited and Central Depository Services (India) Limited. The Company will also display the results of the Postal Ballot at its Registered Office.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evotingnsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800 22 44 30 or send a request to Ms. Pallavi Mhatre at evoting@nsdl.com.

By Order of the Board of Director
For, Arman Financial Services Limited
Sd/-
Jamish Patel, (Company Secretary)
(M No. A4224)

TRADE MARK CAUTION NOTICE - PUBLIC NOTICE

This is to notify all concerned members of trade and public that Shree Renuka Sugars Limited (hereinafter referred to as "Shree Renuka Sugars") a Company registered under the Indian Companies Act, 1956 (as amended from time to time) and having its registered office at CTS No. 10634, 'Kanakeshree Arcade', 2nd & 3rd Floor, JMRC Road, Nehru Nagar, Begavli-590010 is the proprietor of the trade mark:



(hereinafter referred to as the, "aforesaid trade mark") in respect of sugars from 2007 and in relation to jaggery since 2023.

The members of trade and public are hereby cautioned and notified against any unscrupulous manufacturers and traders, with whom Shree Renuka Sugars has no nexus or association whatsoever that may misrepresent or pass off their goods under the aforesaid trade mark and/or its 'formalives' variants or any other mark deceptively similar to our registered trade mark and/or its 'formalives' variants thereof in relation to sugar in class 30. Therefore, the public is hereby cautioned against purchasing goods from any such individuals/entities.

Notice is given to Whosoever It May Concern that any misuse of the aforesaid trade mark and/or its 'formalives' variants thereof or trade mark(s) deceptively similar thereto, by any person(s) not authorized by us, will amount to violation of our statutory as well as common law rights amounting to infringement and/or passing off in relation to the aforesaid trade mark in relation to sugar and jaggery. In the event of any infringement or violation of exclusive rights over the aforesaid trade mark, we would be constrained to initiate appropriate legal action.

For and Behalf of SHREE RENUKA SUGARS LIMITED, Madhur (Division)
Sd/-

Vodafone Idea Next-Gen Solutions Limited
(formerly Vodafone m-pesa Limited)

Regd. Off.: 10th Floor, Birla Centrium, Century Mills Compound, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 030

PUBLIC NOTICE

Notice is hereby given that Vodafone m-pesa Limited has changed its name to Vodafone Idea Next-Gen Solutions Limited with effect from 31 December 2024.

Members of the public who still have an existing full KYC or minimum KYC m-pesa wallet carrying any balance in the wallet may request the Company for closure / transfer / settlement request by writing an email to customercare.vnpl@vodafoneidea.com or letter address to our registered office address along with your current contact details.

For Vodafone Idea Next-Gen Solutions Limited
Date: 19-02-2025
Place: Mumbai
Nitiasha Gawde
Company Secretary

Investing in Government Securities now becomes easier...

Start using **RBI RETAIL DIRECT Mobile App** anytime, anywhere for investment in:

- Government Securities including
- Treasury Bills
- Sovereign Gold Bonds
- Floating Rate Savings Bonds 2020

Download the App Now!



Scan to download RBI Retail Direct Mobile App

Rasika Raju
Indian Badminton Player and RBI Employee

Advantages of RBI Retail Direct Mobile App:

- Access to Government Securities Market at fingertips
- Quick login, simple user interface and easy to navigate
- Multiple payment options - Net Banking, UPI and NACH
- Guaranteed returns on maturity, no brokerage and no hidden fees

Issued in public interest by **भारतीय रिजर्व बैंक RESERVE BANK OF INDIA** www.rbi.org.in

For more details, visit <https://rbiretaildirect.org.in>
Write to us: support@rbiretaildirect.org.in

INVEST MADHYA PRADESH
— INFINITE POSSIBILITIES —
GLOBAL INVESTORS SUMMIT
24 & 25 FEBRUARY 2025, BHOPAL

Narendra Modi, Prime Minister | Dr. Mohan Yadav, Chief Minister

Released by the Department of Public Relations, M.P.

MP INDUSTRIAL DEVELOPMENT CORPORATION LTD.

Infinte Possibilities

Madhya Pradesh Export Policy 2025
Promoting Export Capacity Building

- For the first time, export companies to receive reimbursement of registration-cum-membership certification up to ₹ 10 lakh and export insurance premium up to ₹ 20 lakh
- Assistance up to 10% on export turnover and up to 75% on export marketing
- Reimbursement of up to 50% on infrastructure development and up to 25% on export infrastructure expenditure
- Reimbursement of up to 50% on green industrialization and up to 50% on export green document expenditure
- Up to 25% assistance to Common Processing Facility

www.investmp.in

Designed by: MP, Madhyam/2025

Ahmedabad

केम्ब्रिया बैंक Canara Bank **केम्ब्रिया बैंक** भारतीय रिजर्व बैंक (२०२१) **केम्ब्रिया बैंक** भारतीय रिजर्व बैंक (२०२१)

केम्ब्रिया बैंक भारतीय रिजर्व बैंक (२०२१) **केम्ब्रिया बैंक** भारतीय रिजर्व बैंक (२०२१)

केम्ब्रिया बैंक भारतीय रिजर्व बैंक (२०२१) **केम्ब्रिया बैंक** भारतीय रिजर्व बैंक (२०२१)

केम्ब्रिया बैंक भारतीय रिजर्व बैंक (२०२१) **केम्ब्रिया बैंक** भारतीय रिजर्व बैंक (२०२१)

केम्ब्रिया बैंक भारतीय रिजर्व बैंक (२०२१) **केम्ब्रिया बैंक** भारतीय रिजर्व बैंक (२०२१)

अध वसुली अधिकार-II

अध वसुली अधिकार-II

अध वसुली अधिकार-II

अध वसुली अधिकार-II

अध वसुली अधिकार-II

Maharashtra Industrial Township Limited

Maharashtra Industrial Township Limited

Maharashtra Industrial Township Limited

Maharashtra Industrial Township Limited

Maharashtra Industrial Township Limited

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

COLAMA COMMERCIAL COMPANY LIMITED

COLAMA COMMERCIAL COMPANY LIMITED

COLAMA COMMERCIAL COMPANY LIMITED

COLAMA COMMERCIAL COMPANY LIMITED

COLAMA COMMERCIAL COMPANY LIMITED

अभिनव इन्फ्रास्ट्रक्चर्स लिमिटेड

अभिनव इन्फ्रास्ट्रक्चर्स लिमिटेड

अभिनव इन्फ्रास्ट्रक्चर्स लिमिटेड

अभिनव इन्फ्रास्ट्रक्चर्स लिमिटेड

अभिनव इन्फ्रास्ट्रक्चर्स लिमिटेड

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

यूनिओन बैंक Union Bank

Chola

Chola

Chola

Chola

Chola

SHREE BHAVA FABRICS LIMITED

SHREE BHAVA FABRICS LIMITED

SHREE BHAVA FABRICS LIMITED

SHREE BHAVA FABRICS LIMITED

SHREE BHAVA FABRICS LIMITED

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

NOTICE OF POSTAL BALLOT & REMOTE E-VOTING

NOTICE OF POSTAL BALLOT & REMOTE E-VOTING

NOTICE OF POSTAL BALLOT & REMOTE E-VOTING

NOTICE OF POSTAL BALLOT & REMOTE E-VOTING

NOTICE OF POSTAL BALLOT & REMOTE E-VOTING

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केम्ब्रिया बैंक Canara Bank

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global

केप्री ग्लोबल Capri Global